



RAN-2508000605020010

T.Y.B.Com. (Sem. - V) Examination October - 2025

Advance Accounting & Auditing - Paper VI (Major)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) જમણી બાજુ દર્શાવેલ અંક કુલ ગુણ દર્શાવે છે.
Figures to the right indicate total marks of a question
- (3) તમામ ગણતરી જવાબના ભાગરૂપે દર્શાવો.
Show the necessary calculation as apart of your answer.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

Q. 1. નીચેના પ્રશ્નના જવાબ આપો. (કોઈ પણ પાંચ)

10

1. નાણાકીય પત્રકોના કોઈ પણ ચાર લક્ષણો જણાવો.
2. વ્યાખ્યા આપો: સંચાલકીય હિસાબી પદ્ધતિ
3. એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી રૂ. 250000 અને છેવટની બાકી રૂ. 300000 છે. વર્ષ દરમ્યાન અમુક રોકાણો રૂ.42500 ની કિંમતે વેચવામાં આવ્યા હતા તેમજ અમુક રોકાણો રૂ.90000ની કિંમતે ખરીદવામાં આવ્યા હતા. રોકાણોના વેચાણનો નફો શોધો.
4. તા. 31.3.2024 ના રોજ પાકા સરવૈયામાં મકાન પર ઘસારાની જોગવાઈ રૂ.280000 છે. વર્ષ દરમ્યાન રૂ.100000 ની મૂળ કિંમતનું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો રૂ.60000 છે, તે રૂ.20000 ની કિંમતે વેચવામાં આવ્યું હતું. રૂ.80000 ઘસારો ચાલુ વર્ષ દરમ્યાન નફા નુકશાન ખાતે ઉધારેલ છે. તો 31.3.2025 ના રોજ પાકા સરવૈયામાં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે?
5. પાર્થ લિ. ના ધંધાના પ્રથમ વર્ષના અંતે પાકા સરવૈયામાં નીચેની બાકીઓ હતી.
ઈક્વિટી શેરમૂડી રૂ. 200000
10% ના ડિબેન્ચર રૂ.75000
કાયમી મિલકત રૂ. 75000
કરવેરાની ચુકવણી રૂ. 5000
નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ શોધો.
6. તેજ લિ. નો કાર્યશીલમૂડીમાં ફેરફાર પેલવાનો નફો રૂ.43500 છે. કાર્યશીલમૂડીમાં વર્ષ દરમ્યાન નીચે મુજબના ફેરફાર થયા છે.
દેવાદારમાં ઘટાડો રૂ. 25800
દેવીલુંડીમાં ઘટાડો રૂ. 840
લેણીલુંડીમાં વધારો રૂ. 3880
અગાઉથી ચુકવેલ ખર્ચમાં વધારો રૂ.250
ચુકવવાનો બાકી ખર્ચમાં વધારો રૂ. 780
તેજ લિ. નો કામગીરીમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ શોધો.

7. નીચેની માહિતી પરથી કાચા નફાનો ગુણોત્તર ગણો

વિગત	રૂ.
વેચાણ	100000
ખરીદી	60000
વેચાણ પરત	10000
ખરીદ પરત	15000
શરૂનો સ્ટોક	20000
છેવટનો સ્ટોક	5000

Q. 2 . સોલમ કંપની લિ.ના તા. 31.03.24 અને 31.03.25 ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે.

14

વિગત	31-3-2024 રૂ.	31-3-2025 રૂ.
(I) ઇક્વિટી અને જવાબદારી		
(1) શેરહોલ્ડરના ભંડોળ		
(a) શેરમૂડી		
ઇક્વિટી શેરમૂડી	4,50,000	4,50,000
(b) અનામત અને વધારો		
નફા નુકશાન ખાતું	56,000	68,000
સામાન્ય અનામત	3,00,000	3,10,000
(2) બિન ચાલુ દેવા		
(a) લાંબા ગાળાના ઉછીનાં નાણાં:		
મોર્ગેજ લોન	----	2,70,000
(3) ચાલુ દેવા :		
(a) વેપારી દેવા :		
લેણદારો	1,68,000	1,34,000
(b) ટૂંકા ગાળાની જોગવાઈ :		
કરવેરાની જોગવાઈ	75,000	10,000
કુલ	<u>10,49,000</u>	<u>12,42,000</u>
(II) મિલકતો		
(1) બિન ચાલુ મિલકતો		
(a) કાયમી મિલકતો	4,00,000	3,20,000
(b) બિન ચાલુ રોકાણો	50,000	60,000

(2) ચાલુ મિલકતો :		
(a) માલ સામગ્રી : સ્ટોક	2,40,000	2,10,000
(b) વેપારી લેણાં:		
દેવાદારો	2,10,000	4,55,000
(c) રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો :		
બેંકમાં રોકડ	1,49,000	1,97,000
કુલ	10,49,000	12,42,000

વધારાની માહિતી :

- વર્ષ 2024-25 દરમ્યાન રૂ. 8000 ની પડતર કીમતના રોકાણો રૂ.8500 માં વેચવામાં આવ્યા હતા.
 - વર્ષ દરમ્યાન રૂ.9,000 કરવેરાની જોગવાઈ કરી હતી.
 - વર્ષ દરમ્યાન કાયમી મિલકતનો એક ભાગ જેની પડતરકિમત રૂ.10000 હતી તે રૂ.12000 માં વેચવામાં આવ્યું હતું અને તેનો નફો નફા નુકશાન ખાતે લઈ ગયા હતા.
 - વર્ષ દરમ્યાન ડિવિડન્ડ રૂ. 40000 ચૂકવેલ હતું.
- તૈયાર કરો : (1) કાર્યશીલમુદીમાં ફેરફાર દર્શાવતું પત્રક
(2) સુધારેલું નફા નુકશાન ખાતું
(3) ભંડોળ પ્રવાહ પત્રક

અથવા

Q. 2.

ધંધાના પ્રથમ વર્ષ 2024ના અંતે માલવ કંપનીનું પાકું સરવૈયું

14

વિગત	રકમ(રૂ.)	રકમ (રૂ.)
(I) ઇક્વિટી અને જવાબદારીઓ		
(1) શેરહોલ્ડર ના ભંડોળો :		
(અ) શેરમૂડી: ઇક્વિટી શેરમૂડી		20,00,000
(બ) અનામત વધારો : નફા નુકશાન ખાતું		(50,000)
(2) બિન ચાલુ દેવા : 11%ના ડીબેન્ચર		7,50,000
(3) ચાલુ દેવા:		
(અ) વેપારી દેવા:		
લેણદારો:		5,00,000
દેવીલુંડી		2,50,000
(બ) ટુંકા ગાળાની જોગવાઈ:		
આવકવેરાની જોગવાઈ		2,50,000
સૂચિત ડીવીડન્ડ		2,00,000
કુલ		39,00,000
[II] મિલકતો		
(1) બિન ચાલુ મિલકતો		
(અ) દ્રશ્ય મિલકતો - મશીનરી	30,00,000	
-ઘસારો	2,50,000	27,50,000
(બ) અન્ય બિન ચાલુ મિલકતો		
પ્રાથમિક ખર્ચા	50,000	

- માંડી વાળેલ	50,000	-----
(2) ચાલુ મિલકતો		
(અ) માલસામગ્રી : સ્ટોક		5,00,000
(બ) વેપારી લેણા: દેવાદાર		4,00,000
(ક) રોકડ અને રોકડ સમાન		
બેંકમાં રોકડ		2,50,000
કુલ		<u>39,00,000</u>

હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક બનાવો.

Q. 3

ક્રિદ્ય લિ. ની માહિતીના આધારે નીચે આપેલા ગુણોત્તરોની ગણતરી કરો.

31 માર્ચ, 2025 ના રોજનું પાકું સરવૈયાની બાકીઓ:

14

વિગત	રકમ (રૂ.)
ઈક્વિટી શેર મૂડી	6,00,000
10% પ્રેફરંસ શેર મૂડી	2,00,000
અનામત અને વધારો	2,00,000
12% ના ડિબેન્ચર	4,00,000
લેણદારો	3,00,000
દેવીલુંડી	1,00,000
ચુકવવાનો બાકી ખર્ચ	50,000
કાયમી મિલકત	9,00,000
સ્ટોક	2,50,000
દેવાદાર	2,00,000
રોકડ અને બેંક બેલેન્સ	2,00,000
અગાઉથી ચુકવેલ ખર્ચ	50,000

31 માર્ચ 2025ના પુરા થતા વર્ષની અન્ય માહિતી :

વિગત	રકમ (રૂ.)
વેચાણ	15,00,000
વેચેલ માલની પડતર	10,00,000
કરબાદનો નફો	2,50,000

1, એપ્રિલ 2024ના રોજ સ્ટોક રૂ.2,50,000, કરવેરાનો દર 50% નીચે આપેલા ગુણોત્તરોની ગણતરી કરો :

1. ચાલુ ગુણોત્તર
2. સંચાલન ગુણોત્તર
3. દેવા -ઈક્વિટી ગુણોત્તર (લાંબા ગાળાના દેવાને આધારે)
4. સ્ટોક ગુણોત્તર
5. ચોખ્ખા નફાનો ગુણોત્તર
6. રોકાયેલી મૂડી પર વળતરનો દર

અથવા

Q. 3 (A) નીચેની માહિતીના આધારે ગણો:**06**

1. ચાલુ ગુણોત્તર
2. પ્રવાહી ગુણોત્તર
3. દેવાં-ઈક્વિટી ગુણોત્તર (લાંબા ગાળાના દેવાને આધારે)

રોકડ: રૂ. 30,000	દેવીહુંડી: રૂ. 40,000
બેંક: રૂ. 70,000	ચુ. બાકી ખર્ચ: રૂ. 30,000
દેવાદાર: રૂ. 1,00,000	લાંબાગાળાની લોન: રૂ. 1,50,000
સ્ટોક: રૂ. 1,20,000	ઈક્વિટી શેર મૂડી: રૂ. 2,00,000
લેણીહુંડી: રૂ. 50,000	અનામત: રૂ. 50,000
લેણદાર: રૂ. 80,000	

Q. 3 (B) નવસારી લિ. ની માહિતી નીચે મુજબ છે:**08**

શરુનો સ્ટોક રૂ. 3,00,000	કાચો નફો (વેચાણના 40%) રૂ. 11,20,000
લોનનુ વ્યાજ રૂ. 50,000	વ્યાજ અને કરવેરા પહેલાનો નફો રૂ. 6,20,000
દેવાદાર: રૂ. 5,00,000	કરવેરાનો દર 35%
છેવટનો સ્ટોક: રૂ. 4,40,000	રોકડ વેચાણ - ઉધાર વેચાણના 20%
લેણીહુંડી : રૂ. 1,00,000	

ગણતરી કરો:

1. સ્ટોક ગુણોત્તર
2. દેવાદાર ગુણોત્તર (360 દિવસ)
3. ચોખ્ખા નફાનો ગુણોત્તર
4. સંચાલન ગુણોત્તર

Q. 4 ટૂંકનોંધ લખો (કોઈ પણ ત્રણ)**12**

1. સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ
2. સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર
3. વલણ દર્શાવતી ટકાવારી
4. તુલનાત્મક પાકું સરવૈયું
5. ભંડોળ પ્રવાહ પત્રકના ફાયદાઓ.

ENGLISH VERSION**Q. 1. Answer the following (any five)****10**

1. State any four characteristics of Financial Statement.
2. Define: Management Accountancy
3. In a company, opening balance of the investment was Rs. 250000 and its closing balance was Rs. 300000. During the year, some investments sold for Rs 42500 and new investments were purchased worth Rs. 90000. Find out profit earned on investment sold.
4. Provision for depreciation on building Rs. 280000 in the Balance Sheet as on 31.3.2024. A Building worth Rs. 100000 was sold for Rs.20000 during the year. Which had an accumulated depreciation of Rs. 60000. Rs. 80000 was debited to Profit and Loss Account during the year for depreciation. What will be balance in Provision for depreciation on Building Account in the Balance sheet as on 31.3.2025 ?

5. Following is the balances of Parth Ltd. For the end of very first year.
 Equity share capital Rs. 200000
 10% Debenture Rs. 75000
 Fixed Assets Rs. 75000
 Payment of Tax Rs. 5000
 Find out cash flow from Financial Activities.
6. Net profit before working capital changes of Tej Ltd. Is Rs.43500. Changes in working capital during the year are as follows:
 Decrease in debtors Rs.25800
 Decrease in bills payable Rs. 840
 Increase in bills receivable Rs. 3880
 Increase in prepaid expenses Rs.250
 Increase in outstanding expenses Rs. 780
 Find out Cash flow from operations for Tej Ltd.
7. Calculate the Gross Profit Ratio from the following figures:

	Rs.
Sales	100000
Purchases	60000
Sales return	10000
Purchase return	15000
Opening stock	20000
Closing stock	5000

Q. 2 . The Balance Sheet of Soham Ltd. as at 31.3.2024 and 31.3.2025 are given below **14**

Particulars	31-3-2024 Rs.	31-3-2025 Rs.
(1) Equity and Liabilities:		
(1) Shareholder's Funds:		
(a) Share Capital:		
Equity share capital	4,50,000	4,50,000
(b) Reserve and Surplus:		
Profit and Loss A/C	56,000	68,000
General Reserve	3,00,000	3,10,000
(2) Non-Current Liabilities		
(a) Long-term borrowings:		
Mortgage Loan	----	2,70,000
(3) Current Liabilities:		
(a) Trade Payables:		
Creditors	1,68,000	1,34,000
(b) Short term Provision:		
Provision of Taxation	75,000	10,000
Total Rs.	10,49,000	12,42,000
(2) Assets:		
(1) Non-Current Assets:		
(a) Fixed Assets:	4,00,000	3,20,000
(b) Non-Current Investments	50,000	60,000

(2) Current Assets:		
(a) Materials:		
Stock	2,40,000	2,10,000
(b) Trade Receivables:		
Debtors	2,10,000	4,55,000
(c) Cash and Equivalent Cash:		
Cash at bank	<u>1,49,000</u>	<u>1,97,000</u>
Total Rs.	<u>10,49,000</u>	<u>12,42,000</u>

Additional Information:

- Investment costing Rs.8000 were sold during year 2024-25 for Rs.8500.
- Provision for tax made during the year was Rs.9000.
- During the year, part of the fixed assets costing Rs.10000 was sold for Rs.12000 and the profit was included in the Profit and Loss A/c.
- Dividend paid during the year amounted to Rs.40000.

Prepare : (1) A statement showing changes in working capital

(2) Adjusted Profit & Loss Account

(3) Fund Flow Statement

OR

Q. 2.

Following is the balance sheet of Malav Co. at the end of very first year 2024

14

Particulars	Amount	Amount
[1] Equity and Liabilities:		
(1) Shareholder's Fund:		
(a) Share Capital:		
Equity share capital		20,00,000
(b) Reserve and Surplus:		
Profit and Loss A/c		(50,000)
(2) Non-Current Liabilities:		
11% Debenture		7,50,000
(3) Current Liabilities:		
(a) Trade Payables:		
Creditors		5,00,000
Bills Payable		2,50,000
(b) Short term provision:		
Provision for taxation		2,50,000
Proposed dividend		<u>2,00,000</u>
		<u>39,00,000</u>
[2] Assets:		
(1) Non-Current Assets:		
(a) Fixed Assets:		
(i) Tangible Assets: - Machinery	30,00,000	
- Depreciation	<u>2,50,000</u>	27,50,000
(ii) Other Non-Current Assets:		
Preliminary Expenses	50,000	
- Written off	<u>50,000</u>	-----
(2) Current Assets:		

(a) Materials:		
Stock		5,00,000
(b) Trade Receivable:		
Debtors		4,00,000
(c) Cash and Equivalent Cash:		
Cash in Bank		<u>2,50,000</u>
Total		<u>39,00,000</u>

Prepare cash flow statement as per accounting standard-3.

Q. 3 On the basis of Information of Kriday Industries Ltd., calculate the following ratios:
Balances of Balance Sheet as on 31st March, 2025

14

Particulars	Amount (Rs.)
Equity Share Capital	6,00,000
10% Preference Share Capital	2,00,000
Reserves and Surplus	2,00,000
12% Debentures	4,00,000
Creditors	3,00,000
Bills Payable	1,00,000
Outstanding Expenses	50,000
Fixed Assets	9,00,000
Stock	2,50,000
Debtors	2,00,000
Cash and Bank Balance	2,00,000
Prepaid Expenses	50,000

Other Information for the year ending 31st March, 2025

Particulars	Amount (Rs.)
Sales	15,00,000
Cost of Goods Sold	10,00,000
Net Profit after tax	2,50,000
Stock on 1 st April 2024	Rs.2,50,000 Tax Rate 50%

Calculate the following ratios :

1. Current Ratio
2. Operating Ratio
3. Debt-Equity Ratio (based on long term debt)
4. Inventory Turnover Ratio
5. Net Profit Ratio
6. Return on Capital Employed

OR

Q. 3 (A) From the following information, calculate:

06

1. Current Ratio
 2. Liquid Ratio
 3. Debt-Equity Ratio (based on long term debt)
- Cash: Rs. 30,000
Bank: Rs. 70,000
Debtors: Rs. 1,00,000
Stock: Rs. 1,20,000

Bills Receivable: Rs. 50,000
 Creditors: Rs. 80,000
 Bills Payable: Rs. 40,000
 Outstanding Expenses: Rs. 30,000
 Long-term Loan: Rs. 1,50,000
 Equity Share Capital: Rs. 2,00,000
 Reserves: Rs. 50,000

Q. 3 (B) Following is the information of Navsari Ltd

08

Opening Stock Rs. 3,00,000	Gross Profit (40% of sales) Rs. 11,20,000
Interest on loan Rs. 50,000	Profit before interest and tax Rs. 6,20,000
Debtors: Rs. 5,00,000	Taxation Rate 35%
Closing Stock: Rs. 4,40,000	Cash Sales - 20% of Credit sales
Bills Receivables : Rs. 1,00,000	

Calculate:

1. Stock Turnover Ratio
2. Debtors Ratio (360 Days)
3. Net Profit Ratio
4. Operating Ratio

Q. 4 Write short notes (any three)

12

1. Limitations of Management Accountancy
2. Scope of Management Accountancy
3. Trend Percentage
4. Comparative Balance Sheet
5. Advantages of Fund Flow Statement